https://archive.org/details/bk941/page/n0/mode/1up

All Items on https://archive.org/details/realpatidar
realpatidar.com
Full Library on https://realpatidar.com/library

(૨)

ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમિટી

પીરાણા
પોસ્ટ ગ્યાસપુરા
તા. દસક્રોઈ

ચુંટણીના નીયમો

અમદાવાદના મહેરબાન સીવીલ જજ (સી. ડી.) સાહેબે દી. પ્રા. નં. ૫૨૧/૫૯ ના કામમાં તા. ૨૧-૧-૬૦ના રોજ ધી ઈમામશાહ બાવા રોજા સંસ્થા કમિટિ, પીરાણાના મંજુર કરેલ.

ચુંટણીના નિયમો

"ધી ઈમામશા બાવા રોજા સંસ્થા કમિટી" ના ચુંટણી નીયમો.

સ્કીમના અનુસંધાનમાં :

૧-આ નીયમો ધી ઈમામશા બાવા. રોજા સંસ્થા કમીટીના "ચુંટણી નીયમો" તરીકે ઓળખાશે.

૨-૧-"જ્યાં સુધી કમિટી ઠરાવ દ્વારાં નક્કી કરે નહીં ત્યાં સુધી આ નીયમો કમિટીના સતપંથી મેમ્બરોની ચુંટણીને લાગુ પડશે નહી.

૨-આ નીયમો કોરટની મંજુરી મળતાં તુરતજ અમલમાં આવશે.

૩-આ નીયમોમાં.

અ-મતદાર-એટલે જેનું આ નીયમો અનુસાર તૈયાર કરવામાં આવેલા મતદારના લીસ્ટમાં નામ હોય તેવો સૈયદ હકદાર અથવા સતપંથી જે હોય તે.

બ-"કમિટી" એટલેથી ઈમામશા બાવા રોજા સંસ્થા કમિટી

ક-"મેમ્બર" એટલે કમિટીનો મેમ્બર.

ડ-"ચેરમેન" એટલે નીયમ ૧-અનુસાર કાકા સાહેબે નીયુક્ત કરેલ ચુંટણી અધીકારી.

ઈ-કોર્ટ એટલે અમદાવાદના મહેરબાન સીવીલ જજ સી. ડી. સાહેબની કોર્ટ કે જેને સ્કીમ નીચે ઉપસ્થીત થતી તમામ બાબતો ઉપર હકુમત છે.

realpatidar.com

https://archive.org/details/bk941/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

No specific pages. See whole book.
References by: RealPatidar.com

https://archive.org/details/bk941/page/n2/mode/1up

1960-01-21 -Election Rules -Imam Shah Bawa Trust (941)

realpatidar.com

(૨)

ધી ઈમામશાહ બાવા રોઝા સંસ્થા કમિટી

પીરાણા
પોસ્ટ ગિયાસપુરા
તા. દસક્રોઈ

ચુંટણીના નીયમો

અમદાવાદના મહેરબાન સીવીલ જડજ (સી. ડી.) સાહેબે દી. પ્રા. નં. ૫૨૧/૫૯ ના કામમાં તા. ૨૧-૧-૬૦ના રોજ ધી ઇમામશાહ બાવા રોઝા સંસ્થા કમિટિ, પીરાણાના મંજુર કરેલ.

ચુંટણીના નિયમો

"ધી ઇમામશા બાવા રોજા સંસ્થા કમિટી" ના ચુંટણી નીયમો.

:સ્કીમના અનુસંધાનમાં :

૧-આ નીયમો ધી ઇમામશા બાવા રોજા સંસ્થા કમીટીના "ચુંટણી નીયમો" તરીકે ઓળખાશે.

૧-૧-"જ્યાં સુધી કમિટી ઠરાવ દ્વારા [illegible] [illegible] [illegible] સુધી આ નીયમો કમિટીના સત્પપંથી મેમ્બરોની ચુંટણીને લાગુ પડશે નહી.

૨-આ નીયમો કોરટની મંજુરી મળતાં તુરતજ અમલમાં આવશે.

૩-આ નીયમોમાં.

અ-મતદાર-એટલે જેનું આ નીયમો અનુસાર તૈયાર કરવામાં આવેલા મતદારના લીસ્ટમાં નામ હોય તેવો સૈયદ હકદાર અથવા સત્પપંથી જે હોય તે.

બ-"કમિટી" એટલેથી ઇમામશા બાવા રોજા સંસ્થા કમિટી

ક-"મેમ્બર" એટલે કમિટીનો મેમ્બર.

ડ-"ચેરમેન" એટલે નીયમ -અનુસાર કાકા સાહેબે નીયુક્ત કરેલ ચુંટણી અધીકારી.

ઈ-કોર્ટ એટલે અમદાવાદના મહેરબાન સીવીલ જજ સી. ડી. સાહેબની કોર્ટ કે જેને સ્કીમ નીચે ઉપસ્થીત થતી તમામ બાબતો ઉપર હકુમત છે.

realpatidar.com

https://archive.org/details/bk941/page/n3/mode/1up

1960-01-21 -Election Rules -Imam Shah Bawa Trust (941)

realpatidar.com

૯-"સ્કીમ" એટલે વહીવટ માટેની કોર્ટે નક્કી કરેલી સ્કીમ.

૧-'સંસ્થા" એટલે પી ઇમામશા બાવા રોજા સંસ્થા.

૩-આ નીયમો સ્કીમને આધારીત રહેશે અને આ નીયમો સ્કીમના કોઇપણ ભાગને સ્પર્શી શકશે નહી કે તેમાં ફેરફાર કરી શકશે નહી.

૪-આ નીયમોમાં જે શબ્દો વાપરયા હોય પણ તેનો અર્થ નક્કી કરેલ ન હોય તેનો અર્થ સ્કીમમાં આપેલ અર્થ મુજબ રહેશે.

૫-સ્કીમમાં ગણાવેલ અને નક્કી કરેલ ત્રણ સૈયદ મતદાર વીભાગમાંથી ત્રણ સૈયદો તથા સાત સત્પંથી મતદાર વીભાગમાંથી સાત સત્પંથી સભ્યોની ચુંટણી કરવામાં આવશે.

૬-૧-ગાદીવાલા કાકા સાહેબ મજકુર કમિટીના મેમ્બરોની ચુંટણી કરવા માટે ઇલેક્શન ચેરમેનની નીમણુંક કરશે.

૨-કાકા સાહેબની દેખરેખ, અખીકાર અને સુચના અનુસાર ચેરમેનને મતદારોનું લીસ્ટ બનાવવાની, સુધારવાની અથવા તેની ફેર તપાસ કરવાની સત્તા રહેશે.

૭-કોઇપણ વ્યક્તિ કે જે:- મત આપી શકશે નહિ

અ-સૈયદ હકદાર ન હોય અથવા તો સત્પંથી ન હોય તે

બ-કોઇપણ સ્ત્રી મત આપી શકશે નહી.

૮-એક કરતાં વધારે મત મંડળમાં અથવા તો એકજ મતદાર મંડળમાં એક કરતાં વધારે વખત કોઇપણ વ્યક્તિનું મતદાર તરીકે નામ રજીસ્ટર થઇ શકશે નહીં.

૯-કોઇપણ સત્પંથી મતદાર તરીકે નામ રજીસ્ટર કરતી વખતે ૨૧

અ-સૈયદ હકદાર સિવાય

વરસથી ઓછી ઉમરનો ન હોવો જોઇએ.

ગ-કાનમ, સુરત, અને પેટલાદ વિભાગના સૈયદ હકદાર પીરાણા વિભાગમાં ઓછામાં ઓછું એક વરસ રહેવાથી તેને પીરાણા વિભાગમાં મત આપવાનો અખીકાર પ્રાપ્ત થશે, પણ જો તે મતદાર પીરાણા વિભાગમાંથી બીજા વિભાગનો રહેવાશી થશે તો તે મતદાર મૂળ જે વિભાગનો રહેવાશી હશે તે વિભાગનો મતદાર ગણાશે.

૧૦-ચુંટણી પહેલાં ૭ અઠવાડીયા અગાઉ ચેરમેન મતદાર લીસ્ટ પ્રગટ કરશે.

૧૧-કોઇપણ મતદારનું નામ મતદાર લીસ્ટમાં દાખલ થયું ન હોય તેના મતદારે મતદાર લીસ્ટ પ્રગટ થયે પોતાનું નામ મતદાર લીસ્ટમાં દાખલ કરવા માટે

realpatidar.com

https://archive.org/details/bk941/page/n4/mode/1up

realpatidar.com

કેવી પંદર દીવસની અંદર ચેરમેનને અરજી કરી મતદાર તરીકે પોતાનું નામ મતદાર લીસ્ટમાં દાખલ કરાવવું પડશે.

૧૨- દાદા સાહેબની દેખરેખ નીચે ચેરમેન

અ- કમિટીના ઉમેદવારો માટે નોમીનેશનની છેલ્લી તારીખ તથા,

બ- મતદાન લેવાની તારીખ નક્કી કરશે.

૧૩- મતદાર લીસ્ટમાં જે વ્યક્તિનું નામ નહીં હોય તે ચુંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રહી શકશે નહીં.

૧૪- સંસ્થાને કોઈપણ ખેડૂત તથા સંસ્થાનો દેવાદાર ચુંટણીમાં ઉમેદવાર તરીકે ઉભો રહી શકશે નહીં.

૧૫- ચુંટણી માટે નીમાયેલ ચેરમેન ચુંટણીની નક્કી કરેલ તારીખની તેમજ નોમીનેશનની ઠરાવેલ તારીખ તથા ઉમેદવારી પાછી ખેંચી લેવાની ઠરાવેલ તારીખની ખબર સ્થાનિક પેપરોમાં આપશે તેમજ સંસ્થાની નોટીસ બોર્ડ પર નોટીસ ચોડશે.

૧૬- ચુંટણીમાં ઉભા રહેલ ઉમેદવારે પોતાનું ચુંટણી માટે પસંદ કરેલ નીશાન, નામ, મતદાનની તારીખના આઠ દીવસ અગાઉ ચેરમેનને જાહેર કરવું પડશે.

૧૭- દરેક ઉમેદવારનું નામ તથા નીશાન તથા મતદાન વિભાગ (મતપેટી) બોર્ડ બોક્સ પર ચોંટાડવામાં આવશે.

૧૮. ચુંટણીમાં ઉભા રહેલ જે ઉમેદવાર માટે મતદાર મત આપવાની-

અ- ઈચ્છા રાખતો હોય તેવા ઉમેદવારનું નામ, નીશાન તથા મતદાર વિભાગ દર્શાવતી મતપેટીમાં પોતાનું બેલેટ પેપર (મતપત્ર) નાંખી દરેક મતદાર પોતાનો મત આપશે.

બ- દરેક મતદાર પોતાના વીભાગમાં ઉભા રહેલ ઉમેદવારોમાંથી એકજ ઉમેદવારને મત આપી શકશે.

૧૯- ચુંટણી વખતે જ્યારે મતદાન લેવામાં આવે ત્યારે ઉમેદવાર પોતે અથવા એમના તરફથી અધીકૃત એજન્ટ હાજર રહી શકશે તેમજ મતદાનની ગણતરી વખતે પણ ઉમેદવાર જાતે અથવા અધીકૃત એજન્ટ હાજર રહી શકશે.

૨૦- મત ગણતરી પુરી થાય કે તરતજ ચેરમેન પરિણામ જાહેર કરશે પરીણામ જે તારીખે જાહેર કરવામાં આવશે તેજ તારીખ સભ્યોની ચુંટણી તારીખ ગણવામાં આવશે.

realpatidar.com

https://archive.org/details/bk941/page/n5/mode/1up

realpatidar.com

૪

૨૧- જે ઉમેદવારને સૌથી વધારે મત મળ્યા હશે તેને તે વીભાગમાંથી ચુંટાયેલા જાહેર કરવામાં આવશે.

૨૨- કોઈપણ મત વીભાગમાં ઉમેદવારોને સરખા મત મળ્યા હશે તો ચુંટણી માટે નીમાયેલા ચેરમેન લોટ નાંખી ચુંટણીનું પરિણામ જાહેર કરશે.

૨૩- ચુંટણીમાં ઉભા રહેલ કોઈપણ ઉમેદવાર અથવા મતદાર ચુંટણીમાં ચુંટાયેલા સભ્ય વીરુધ અમદાવાદના સીવીલ જજ સી. ડી. ની કોરટમાં ચુંટણીની તારીખથી ૩૦ દીવસની અંદર અરજી કરી શકશે.

ચુંટણીના આ નીયમો સ્કીમની કલમ ૨-એ બી-સી ૪ અને ૫ ના અનુસંધાનમાં છે.

કમિટીએ આ ધારા ધોરણ સર્વાનુમતે મંજુર કર્યા છે.

(સહી) ઠાકર રામજી લક્ષ્મણ
ચેરમેન

તા. ૮-૧૧-૫૮

તા. ૮-૧૧-૫૮ ના રોજ ભરાયેલ કમિટીની બેઠકમાં સર્વાનુમતે થયેલ ઠરાવની ખરી નકલ.

(સહી) ઠાકર રામજી લક્ષ્મણ
ચેરમેન

તા. ૮-૧૧-૫૮

realpatidar.com